



ઈ-ઈન વોઈસ એવિડેન્સિબિલિટી પર તાજેતરના અપડેટ્સ

TRIVEDI PARIKH & SHAH

CHARTERED ACCOUNTANTS

ઈ-ઈનવોઈસ એપ્લિકેબિલિટી પર તાજેતરના અપડેટ્સ

- ▶ ૧ ઓગસ્ટ, ૨૦૨૩ થી GST ઈ-ઈનવોઈસિંગ માટેની થ્રેશોલ્ડ મર્યાદાને દસ કરોડ રૂપિયાથી ઘટાડીને પાંચ કરોડ રૂપિયા, અમલમાં મુકવામાં આવી.
- ▶ વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા તમામ કરદાતાઓ માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત રહેશે.

ઈ-ઈનવોઈસ એપ્લિકેબિલિટી પર તાજેતરના અપડેટ્સ

- હાલમાં કયા દસ્તાવેજો ઈ-ઈનવોઈસિંગ હેઠળ આવરી લેવામાં આવ્યા છે?
 - ▶ હાલમાં ઈ-ઈનવોઈસ હેઠળ કરદાતાઓના સૂચિત વર્ગ દ્વારા (રજિસ્ટર્ડ વ્યક્તિઓને (B2B) અથવા નિકાસના(Export) હેતુ માટે) જારી કરવામાં આવતા
 - (1) ટેક્ષ ઇન્વોઈસ,
 - (2) ક્રેડિટ નોટ્સ,
 - (3) ડેબિટ નોટ્સઆવરી લેવામાં આવે છે.
 - ▶ ઈ-ઈનવોઈસિંગ નીલ-રેટ અથવા એક્સમ્પટ સપ્લાય માટે લાગુ પડતું નથી.

ઈ-ઈનવોઈસ એપ્લિકેબિલિટી પર તાજેતરના અપડેટ્સ

- કઈ સંસ્થાઓ/ક્ષેત્રો/કરદાતાઓ માટે ઈ-ઈનવોઈસિંગ લાગુ નથી?
 - સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(SEZ) યુનિટ્સ
 - વીમા કંપનીઓ
 - નોન-બેંકિંગ નાણાકીય કંપની (NBFC) સહિત બેંકિંગ કંપનીઓ અથવા નાણાકીય સંસ્થાઓ
 - ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (GTA) (જે માલસામાનની ગાડીમાં માર્ગ દ્વારા માલના પરિવહનના સંબંધમાં સેવાઓ પૂરી પાડે છે)
 - પેસેન્જર પરિવહન સેવાના સપ્લાયર્સ
 - મલ્ટિપ્લેક્સ સ્કીનમાં સિનેમેટોગ્રાફ ફિલ્મોના પ્રદર્શનમાં પ્રવેશ દ્વારા સેવાઓના સપ્લાયર્સ
 - CGST નિયમો (OIDAR) ના નિયમ 14 ની શરતોમાં નોંધાયેલ વ્યક્તિઓ

ઈ-ઈનવોઈસ એપ્લિકેબિલિટી પર તાજેતરના અપડેટ્સ

- જો તમારું ટર્નઓવર વર્તમાન નાણાકીય વર્ષમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય, તો પછી આવતા નાણાકીય વર્ષની શરૂઆતથી ઈ-ઈનવોઈસિંગ શરૂ કરવું જરૂરી રહેશે.
- ઉદાહરણ, જો તમે ૨૦૨૧-૨૨ દરમિયાન થ્રેશહોલ્ડને પાર કરી ગયા હોય, તો ઈ-ઈનવોઈસિંગ ૧ એપ્રિલ, ૨૦૨૨ થી લાગુ થશે.

TRIVEDI PARIKH & SHAH

CHARTERED ACCOUNTANTS

- ◆ 311-12, સુખસાગર કોમ્પ્લેક્સ, હોટેલ ફોર્ચ્યુન લેન્ડમાર્કની બાજુમાં, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, અમદાવાદ- 380013
- ◆ +91-9737101299, 079-27550793
- ◆ cadhruvparikh@gmail.com

Disclaimer : These updates are meant for information purpose only and does not purport to be advice or opinion, legal or otherwise, whatsoever. These updates are based on understanding of the provisions as stood applicable on date. We are not responsible for any error or omission in this update or for any action taken based on its contents.